



RAN-2408000105051004

T.Y.B.Com.(Sem. - V) Examination December - 2025

Banking (Paper : VI)

[Total Marks: 50]

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

પ્ર. 1 (A) યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો.

(10)

- જે 12 માસ કરતાં ઓછા સમય માટે NPA રહે તે લોનને શું કહી શકાય?
A) શંકાસ્પદ અસ્ક્યામતો B) સાધારણ અસ્ક્યામતો
C) નુકશાન D) કોઈ પણ નહિ
- કોમર્શિયલ પેપરની મહત્તમ પાકતી મુદત કેટલી?
A) 170 દિવસ B) 365 દિવસ
C) 120 દિવસ D) 160 દિવસ
- રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા નીચે પૈકી કયું કાર્ય કરતી નથી?
A) વિદેશી હુંડિયામણનું નિયમન B) વિનિમય દરની જાળવણી
C) વિશ્વ બેન્કને લોન D) ઉપરોક્ત કોઈ નહિ.
- ચૂકવણી બેન્ક નીચે પૈકી શું બહાર પાડી શકતી નથી?
A) ATM કાર્ડ B) ડેબિટ કાર્ડ
C) ક્રેડિટ કાર્ડ D) ઉપરોક્ત તમામ
- ભારતમાં ચૂકવણી બેન્ક શરૂ કરવાનો પ્રસ્તાવ કોના દ્વારા મૂકવામાં આવ્યો હતો?
A) પિયુષ ગોયલ B) નિર્મલા સિતારામન
C) નીતિન ગડકરી D) અરુણ જેટલી
- મધ્યસ્થ બેન્કને તેના નાણાકીય અને બેંકિંગ માળખાના શિખર તરીકે કોણ વ્યાખ્યાયિત કરે છે?
A) વીરા સ્મિથ B) એડમ સ્મિથ
C) એમ.એમ. ડીકોક D) પ્રો. શોને
- કેટલી ખાનગી સંસ્થાઓને પેમેન્ટ બેન્ક તરીકે શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી?
A) 11 B) 13
C) 15 D) 10
- નીચેનામાંથી કયું કાર્ય આર.બી. આઈ.ના વિકાસલક્ષી કાર્યોમાં સમાવિષ્ટ નથી?
A) કૃષિ પ્રણાલિને પ્રોત્સાહન આપવાનું કાર્ય
B) બેંકિંગ સિસ્ટમમાં તંદુરસ્ત વિકાસ માટે.
C) વિદેશી હુંડિયામણનું સંચાલન અને વિકાસ.
D) ઉપરોક્તમાંથી કોઈ નહિ.

9. ભારતમાં મની માર્કેટનો સૌથી સક્રિય વિભાગ નીચેનામાંથી કયો છે?
 A) કોલ મની / નોટિસ મની માર્કેટ B) રેપો / રિવર્સ રેપો
 C) કોમેર્શિયલ પેપર D) પ્રમાણપત્ર જમા
10. નોન-પરફોર્મિંગ લોન તરીકે પણ ઓળખાય છે.
 A) અવેતન લોન B) બાકી લેણાં
 C) ખરાબ લોન D) કોલેટરાઈઝડ લોન

B) જોડકા જોડો.

(05)

I	બેન્કનું રાષ્ટ્રીયકરણ	A	1949	
II	બેંકિંગ નિયમન ધારો	B	1991	
III	ઈંપિરિયલ બેન્કનું રાષ્ટ્રીયકરણ	C	1969	
IV	બ્લોક ચેન ટેકનોલોજીની શરૂઆત	D	1978	
V	નોટબંધી	E	1955	

પ્ર. 2 ટૂંકમાં જવાબ આપો. (ગમે તે ચાર)

(08)

- ન્યૂયોર્કના નાણાંબજારના ઘટકો જણાવો.
- મોર્ગેજનો અર્થ સમજાવો.
- ડીજીટલાઈઝેશન એટલે શું?
- નાણાંબજાર અને મૂડીબજાર વચ્ચે શું ભેદ છે?
- આર્થિક સ્થિરતા વિશે સમજાવો.
- યુ.કે. અને યુ. એસ. એ. ની મધ્યસ્થ બેન્કના નામ જણાવો.
- શાખ નિયંત્રણ એટલે શું?
- ફાઈનાન્સિયલ સર્વિસના કાર્યો જણાવો.

પ્ર. 3 વાણિજ્ય બેન્ક એટલે શું? વાણિજ્ય બેન્કના કાર્યોની વિસ્તૃત ચર્ચા કરો.

(13)

અથવા

પ્ર. 3 ન્યૂયોર્ક નાણાં બજારનું સંગઠન અને કાર્ય પદ્ધતિ સમજાવો.

(13)

પ્ર. 4 A) ટૂંક નોંધ લખો. (ગમે તે બે)

(07)

- વાણિજ્ય બેન્કના કાર્યો.
- મોબાઈલ બેંકિંગ.
- બ્લોક ચેઈન
- બેન્ક ઓફ ઈંગ્લેન્ડની નાણાકીય નીતિના મુખ્ય સાધનો.

B) ટૂંક નોંધ લખો. (ગમે તે બે)

(07)

- બેંકોના દસ્તાવેજોનું મહત્વ.
- સમજાવો- 'યુપીઆઈ બેંકિંગ ક્ષેત્રની મહત્વની પેમેન્ટ સિસ્ટમ છે.
- મધ્યસ્થ બેંક અને આર્થિક સ્થિરતા.
- યુ.પી. આઈ.

ENGLISH VERSION

Q. 1 (A) Choose the correct option.

(10)

1. What can be called a loan which remains NPA for less than 12 months?
A) Suspicious assets B) Ordinary assets
C) Loss D) None of the above
2. What is the maximum maturity of commercial paper?
A) 170 days B) 365 days
C) 120 days D) 160 days
3. Which of the following is not done by the Reserve Bank of India?
A) Regulation of foreign exchange
B) Maintenance of exchange rate
C) Loan to World Bank
D) None of the above.
4. Which of the following cannot be issued by a payment bank?
A) ATM card B) Debit card
C) Credit card D) All of the above.
5. Who proposed to start a payment bank in India?
A) Piyush Goyal B) Nirmala Sitharaman
C) Nitin Gadkari D) Arun Jaitley
6. Who defines the Central Bank as the pinnacle of its financial and banking structure?
A) Veera Smith B) Adam Smith
C) M.M. Decock D) Prof. Shone
7. How many private institutions were allowed to start as payment banks?
A) 11 B) 13
C) 15 D) 10
8. Which of the following functions is not included in the developmental functions of RBI?
A) The function of promoting the agricultural system.
B) For healthy development in the banking system.
C) Management and development of foreign exchange.
D) None of the above.
9. The most active segment of the Money Market in India is which one of the following?
A) Call Money / Notice Money Market
B) Repo / Reverse Repo
C) Commercial Paper (CP)
D) Certificate of Deposit (CD)
10. Non-performing loans are also known as -
A) Unpaid loans B) Over dues
C) Bad loans D) Collateralized loans

B) Match the following.

(05)

I	Nationalization of Bank	A	1949	
II	Banking Regulation Act	B	1991	
III	Nationalization of Imperial Bank	C	1969	
IV	Block chain technology initiated	D	1978	
V	Demonetization	E	1955	

- Q. 2 Answer in brief. (Any four) (08)**
1. State the Component of Newyork Money Market.
 2. Explain the meaning of Mortgage?
 3. What is meant by Digitalization?
 4. What is the difference between Money market and Capital Market?
 5. Explain the financial stability.
 6. Give the name of Central bank of U.K. and U.S.A.
 7. What is credit control?
 8. State the functions of financial services.
- Q. 3 What is commercial bank? Explain in detail the functions of commercial bank. (13)**
- OR**
- Q. 3 Explain the performance evaluation and organization of New York money market. (13)**
- Q. 4 A) Write short note. (Any two) (07)**
1. Functions of Commercial Bank.
 2. Mobile Banking.
 3. Block Chain
 4. Key instruments of Bank of England monetary policy.
- B) Write short note. (Any two) (07)**
1. Importance of Bank's documents.
 2. Explain - "UPI is the important system of Banking Payment System."
 3. Central Bank and Economic Stability.
 4. UPI
-